



ત્વરિત જાહેરાત માટે

### બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં કન્ફર્મ્ડ (પાક્કો) COVID-19 કેસ અંગે સીટી ઓફ બ્રેમ્પટનનું નિવેદન

મંગળવાર, માર્ચ 24, 2020

સોમવાર, માર્ચ 23 નાં રોજ, સીટી ઓફ બ્રેમ્પટનને માહિતગાર કરવામાં આવ્યું હતું કે આપણી ક્લાર્ક ફેસિલિટીના ટ્રાન્ઝિટ ઓપરેટરનું COVID-19 પરીક્ષણ હકારાત્મક (પોઝિટિવ) આવ્યું હતું. આ બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો પહેલો કન્ફર્મ્ડ કેસ છે.

આપણી ટીમ આ ઓપરેટરના સંપર્કમાં છે જે ઘરે સેલ્ફ-આઈસોલેશનમાં છે.

આ સમયે, સીટીની ટોચની અગ્રતા અસર પામેલી વ્યક્તિ અને તેઓના કુટુંબીજનોને સહાયતા પૂરી પાડવાની, અને અમારા કર્મચારીઓ અને આપણાં સમુદાયની સુરક્ષા અને આરોગ્યને સંરક્ષણની મદદ ચાલુ રાખવાની છે.

સીટીને જાણ થઈ એટલે તરત જ, કર્મચારીઓ પીલ પબ્લિક હેલ્થનો સંપર્ક કર્યો હતો અને ત્યારથી કર્મચારીઓ તેઓના સંપર્કમાં છે. પીલ પબ્લિક હેલ્થ આ ઓપરેટર સાથે ઘનિષ્ટ સંપર્કમાં રહેલા કર્મચારીઓનો સીધો સંપર્ક કરી રહ્યું છે. પબ્લિક હેલ્થ સંપર્ક કરાયેલા કર્મચારીઓને આગામી પગલાઓ લેવા અંગે સલાહ આપશે, જેમાં તેઓ સંસર્ગમાં આવ્યા ત્યારથી 14 દિવસ સુધી સેલ્ફ-આઈસોલેશનમાં રહેવાની અને પોતાના લક્ષણો પર દેખરેખ રાખવાની સૂચના સામેલ છે. પીલ પબ્લિક હેલ્થ જાણાવે છે કે સામાન્ય સમુદાયને જે જોખમ હોય તેના કરતા કોઈ વધારાનું જોખમ ટ્રાન્ઝિટ બસ પ્રવાસીઓને રહેતું નથી.

આ સમયે, એ જાણી લેવાયું છે કે ઓપરેટરે માર્ચ 10, 11, 12, અને 13 નાં રોજ નીચેના રૂટ્સ પર કામ કર્યું હતું:

- 11 સ્ટીલ્સ
- 51 હેરફોર્ડ
- 53 રે લોસન
- 57 શેરોલેસ

પીલ પબ્લિક હેલ્થ અને સીટી ઓફ બ્રેમ્પટન વિગતવાર સમય સમજવા સાથે મળીને કામ કરી રહ્યા છે.

ઉપર જાણાવેલા દિવસોએ સમીક્ષા હેઠળના લોકો જેઓને સારું લાગતું હોય, કોઈ લક્ષણો ના જાણાતા હોય, તેઓએ પોતાની રોજીંદી દિનચર્યા ચાલુ રાખવી જોઈએ અને પબ્લિક હેલ્થને ફોન કોલ ના કરવો જોઈએ. જો તમને લક્ષણો વિકસે તો, કૃપા કરી પીલ પબ્લિક હેલ્થને કોલ કરો. જો તમને ઈમરજન્સી મેડિકલ સહાયતા જોઈતી હોય તો, કૃપા કરી 911 નંબર પર કોલ કરો.



સીટી સમુદાયને ખાતરી કરાવે છે કે તે પોતાના કર્મચારીઓ, ગ્રાહકો અને સમુદાયોની સુરક્ષા સંરક્ષિત કરવામાં મદદ માટે બંધું કરવાનું ચાલુ રાખશે.

વધારે સારી સફાઈ અને ચેપનાશક સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. આ સમયે, અમે ચેપરહિત પ્રક્રિયા દર 24 કલાકે કરી રહ્યાં છીએ. સગવડો અને ટર્મિનલ લંચરૂમ્સ, ટેબલ્સ, કાઉન્ટર્સ અને ડોર હેન્ડલ્સને દિવસમાં બે વખત સાફ અને ચેપરહિત કરવામાં આવી રહ્યાં છે.

ઓપરેટરો અને ઉતારુઓ માટે સામાજિક અંતર જાળવવાને સહાયરૂપ થવા:

- બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠકો સુધી સીમિત કરેલ છે.
- રીયર ડોર્સ (પાછળના ભાગના દરવાજાઓ) મારફતે પ્રવેશ અને ફ્રી ફેર્સ (ભાડું ચૂકવ્યા વગર પ્રવાસ) અમલમાં છે. વધુમાં, અમે મોબિલિટી ડિવાઈસીસ (ચલાયમાનતા સાધનો) ધરાવતા લોકો માટે ફ્રન્ટ ડોર્સ (આગળના દરવાજેથી) પ્રવેશ ચાલુ રાખ્યો છે ત્યારે, ઓપરેટરો અને ઉતારુઓ વચ્ચે જગ્યા પૂરી પાડવા પ્લાસ્ટિકની ચેઈન જેવો અવરોધ મૂકી રહ્યાં છીએ.
- બહુ વ્યસ્ત રૂટ્સ પર, ઉતારુઓ બસમાં હોય તે વખતે સામાજિક અંતર જાળવવા ઉતારુઓની ક્ષમતામાં સહાયરૂપ થવા આર્ટિક્યુલેટેડ બસો મૂકવામાં આવી છે.
- બેઠકોને પીળી ટેપથી ઓળખવામાં આવે છે અને ઉતારુઓને આ બેઠકો પર ન બેસવાનું કહેવામાં આવ્યું છે.

સીટીએ પીલ પબ્લિક હેલ્થમાં અમારા ભાગીદારો સાથે ઘનિષ્ટપણે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તેઓની તપાસ ચાલી રહી છે ત્યારે, નવી માહિતી ઉપલબ્ધ થાય એટલે માહિતી પૂરી પાડવામાં આવશે.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક:

મોનિકા ઢુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)